



**RP WEB SOLUTIONS**  
Website For Everyone...

**Ronak Palan**  
Web Consultant

+91 84888 55506

rpwebsolutions2020@gmail.com

(ટેક્સ સંલગ્ન તથા અન્ય મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરતું માસિક)

# ટેક્સ ટુડે

RNI No.GUJGUJ/2016/74805

**Tax Today**  
(Monthly)

Website  
flamingoclubresort.com



Club & Resort  
Starting Soon  
Delwada-Diu Road, Una.

Contact  
+91 98244 21700  
+91 95589 87734  
+91 99241 21700

Post. Regn. No. G-JND/338/2020-2022. - Office of posting Una Post Office on 3<sup>rd</sup> Monday of Every Month

◆ વર્ષ: ૬, ◆ અંક: ૮, ◆ સળંગ અંક: ૬૮, ◆ તા.૧૮/૦૬/૨૦૨૨, શનિવાર, ◆ પાના-૪, ◆ છૂટક અંકની કિંમત રૂ.૨૦, ◆ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/- (કુરીયર સાથે રૂ.૩૦૦/-) ◆ તંત્રી-માલિક અને પ્રકાશક: ભવ્ય ટિપકભાઈ પોપટ, ◆ પ્રકાશન સ્થળ: ૨૦૨-૨૦૩, ધ્રુવ કોમ્પ્લેક્સ, પોલીસ લાઈન સામે, ઉના, જી.ગીર સોમનાથ-૩૬૨૫૬૦ ◆ ફોન : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, ફેક્સ: ૦૨૮૭૫-૨૨૧૭૦૦, મો. : ૯૯૨૪૧ ૨૧૭૦૦ ◆ મુદ્રણ સ્થળ : પ્રથમેશ ઓફસેટ, ગોંદરા ચોક, ઉના

e-mail: taxtodayuna@gmail.com ◆ e-mail: editor@taxtoday.co.in ◆ www.taxtoday.co.in

પ્રતિશ્રી,

## ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: એડવોકેટ હર્નિશ મોઢ બન્યા સંસ્થાના નવા પ્રમુખ

**એડવોકેટ જયેશ શાહ બન્યા ઉપપ્રમુખ: એડવોકેટ શૈલેષ મકવાણા તથા એડવોકેટ શશાંક મીઠાઈવાલા સુરત બન્યા સેક્રેટરી, ટ્રેસરર તરીકે એડવોકેટ નરેન્દ્રભાઈ કરકર**

તા. ૨૪.૦૫.૨૦૨૨: જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરતાં ગુજરાતના પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની ૬૮મી વાર્ષિક સાધારણ સભા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડિંગ ખાતે યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના ગત વર્ષની કામગીરી અંગે પ્રમુખ વિનોદભાઈ પરમાર તથા સેક્રેટરી શૈલેષ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના હિસાબો ખજાનચી નરેન્દ્ર કરકર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેને સભ્યો દ્વારા બહુલી આપવામાં આવી હતી.

સંસ્થાના મુખપત્ર એવા સેલ્સ ટેક્સ જર્નલના તમામ લેખકોને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. આ સેલ્સ ટેક્સ જર્નલના વર્ષ ૨૦૨૧-૨૨ના શ્રેષ્ઠ લેખ તરીકે દેવેનભાઈ શેઠના લેખની પસંદગી કરવામાં આવી હતી. સંસ્થાના વરિષ્ઠ સભ્ય એવા લલિતભાઈ લેઉવાને બેસ્ટ કોલમ રાઈટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સભ્યોના બાળકો કે જેઓએ કઠઈ સહિતની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવામાં આવ્યા હોય તેમનું એસોસીએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની ખેલ અંગેની પ્રવૃત્તિઓમાં પણ વિજેતા તથા રનર્સ અપને



ટ્રોફી આપવામાં આવી હતી. સંસ્થાના બંધારણમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા જેને આ સામાન્ય સભામાં બહુલ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ ની નવી કારોબારીની બિનહરીફ વરણી થઈ હતી. સંસ્થાના નવા પ્રમુખ તરીકે યુવાન એડવોકેટ હર્નિશભાઈ મોઢની નિમણૂક કરવામાં આવી છે.

સભાના અંતે સેક્રેટરી શૈલેષભાઈ મકવાણા દ્વારા આભારવીધી કરવામાં આવી હતી. સંસ્થાના વરિષ્ઠ સભ્યો નયનભાઈ શેઠ, પ્રદીપભાઈ જૈન, નિગમભાઈ શાહ, વારીશભાઈ ઈશાની, તેજસભાઈ શાહ અનેક પૂર્વ પ્રમુખ, આઉટસ્ટેશન (અમદાવાદ સિવાયના શહેરોમાંથી) ના આગેવાનો પૈકી, જામનગરથી અશ્વત્થાભાઈ વ્યાસ, ડીસાના શાંતિભાઈ ઠક્કર, વડોદરાથી ભાસ્કરભાઈ પટેલ, સુરતથી પ્રશાંતભાઈ શાહ, જુનાગઢથી હેમંગભાઈ શાહ વગેરે ખાસ સાધારણ સભામાં હાજર રહ્યા હતા. વર્ષ ૨૦૨૧-૨૨માં આઉટસ્ટેશન વતી હોદ્દાઓ તરીકે ઉત્કૃષ્ટ સેવા આપનાર ફરીટભાઈ પટેલ તથા જયેશભાઈ કાનાણીનો બહારગામના સભ્યો દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી.

(ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે.)

## Tax Advocate Association Gujarat (TAAG)ની ૪૮મી વાર્ષિક સાધારણ સભાનું થયું આયોજન: પંકજ શાહ બન્યા નવા પ્રમુખ

**TAAGના એડવોકેટ સભ્યો ઉપરાંત TAAG લેડિઝ વિંગના સભ્યો પણ રહ્યા ખાસ ઉપસ્થિત**



તા. ૦૨.૦૬.૨૦૨૨: ગુજરાતના એક માત્ર ટેક્સ એડવોકેટ માટેના સંગઠન એવા Tax Advocate Association Gujarat (TAAG)ની ૪૮મી વાર્ષિક સાધારણ સભા ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ૩૧ મે ૨૦૨૨ ના રોજ પ્રમુખ પ્રતિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ વાર્ષિક સભામાં મોટી સંખ્યામાં એડવોકેટ સભ્યો હાજર રહ્યા હતા. એસોસીએશનના સભ્યોના પરિવારના સભ્યોની બનેલી લેડિઝ વિંગના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. AGMમાં એજન્ડા મુજબ ગત વર્ષની મિટિંગના ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રમુખ પ્રતિક પટેલ દ્વારા વર્ષ દરમિયાન સંસ્થાની કારોબારી સમિતિના સભ્યો, વિભિન્ન સભ કમિટીના ‘કન્વેનર’ તથા ‘કો-કન્વેનર’ને મેમેન્ટો આપી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના સ્થાપક સભ્ય એવા ધીરેશભાઈ ટી. શાહ, ની નિમણૂક વેસ્ટ ઝોન ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીમાં થતાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની આગામી વર્ષની નવી સમિતિની સ્થાપના વિધિ પણ આ મિટિંગમાં કરવામાં આવી હતી. એસોસીએશનના નવા પ્રમુખ તરીકે પંકજભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે કિંજલભાઈ શાહ, સેક્રેટરી તરીકે બિંદેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પિનાકીનભાઈ પટેલ તથા ટ્રેસરર તરીકે જયદીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ દ્વારા સભ્યોને ખાત્રી આપવામાં આવી હતી કે એસોસીએશનના તથા તેના સભ્યોના ઉત્કર્ષ માટે તેઓની ટિમ પોતાના પૂરતા પ્રયત્નો કરશે. સંસ્થા જ્યારે પોતાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભવ્ય પ્રોગ્રામ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

(ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે)

## ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા



**હર્નિશ મોઢ**  
પ્રમુખ



**શૈલેષ મકવાણા**  
સેક્રેટરી



**શશાંક મિઠાઈવાલા**  
સેક્રેટરી

**ભવ્ય પોપટ-એડિટર અને ટેક્સ ટુડે પરિવાર**

## ટેક્સ એડવોકેટ એસોસીએશન-ગુજરાતના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા



**પંકજ શાહ**  
પ્રમુખ



**બિંદેશ શાહ**  
સેક્રેટરી

**ભવ્ય પોપટ-એડિટર અને ટેક્સ ટુડે પરિવાર**

## કમિશનર અપીલ ૨૦% થી ઓછી રકમ ભરવા આદેશ કરી શકે છે કમિશનર અપીલ ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇન્ટરનલ સર્ક્યુલર બાદ્ય નથી: તેલંગાણા હાઈકોર્ટ

તા. ૩૧.૦૫.૨૦૨૨: ઇન્કમ ટેક્સ હેઠળ પ્રથમ અપીલ સાંભળવા જવાબદાર કમિશનર અપીલ ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રશાસનિક સર્ક્યુલર લાગુ પડે નહીં. કમિશનર અપીલ એ કવાસી જ્યુડિશિયલ ઓથોરીટી ગણાય, આ કારણે તેઓની ઉપર ડિપાર્ટમેન્ટના પ્રશાસનિક સર્ક્યુલર લાગુ પડે નહીં. ઇન્કમ ટેક્સ હેઠળની આકારણીમાં ઊભી થયેલ ડિમાન્ડ, સ્ટે કરવા બાબતેના એક કેસમાં તેલંગાણા હાઈકોર્ટ દ્વારા આ પ્રમાણેનો ચુકાદો આપવામાં આવેલ છે. અરાજકર્તા દ્વારા કમિશનર અપીલની સમક્ષ આકારણીમાં ઊભું થયેલ માંગણું સ્થગિત કરવા (સ્ટે) અરજ કરવામાં આવી હતી. કમિશનર અપીલ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો ૩૧ જુલાઈ ૨૦૧૭ ના ઇન્ટરનલ સર્ક્યુલરનો ઉલ્લેખ કરી ડિમાન્ડના ૨૦% જેવી રકમ કરદાતાને ભરવા

આગ્રહ રાખતો આદેશ પસાર કરવામાં આવ્યો હતું. આ આદેશ સામે અરજકર્તા દ્વારા તેલંગાણા હાઈકોર્ટના દ્વાર ખટબટાવ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના જ સિટસ ઉજ્જલ ભૂયાન તથા સુરેષાલી નંદાની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટના પ્રિન્સિપાલ કમિશનર વી. L G ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રા. લી ના ચુકાદાનો આધાર લઈ કરાવ્યું હતું કે કમિશનર અપીલને “કવાસી જ્યુડિશિયલ ઓથોરીટી” ગણાય અને તેના ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇન્ટરનલ સર્ક્યુલર લાગુ પડે નહીં. આમ, કમિશનર અપીલ સંજોગો પ્રમાણે ૨૦% કરતાં ઓછી રકમની ડિમાન્ડ ભરવા આદેશ કરી ડિમાન્ડ સ્ટે કરવા હક્કદાર છે. આ ચુકાદો વિવિધ કમિશનર અપીલ્સ પાસે પડેલ વિવિધ આપીલો માટે ઉપયોગી બનેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

**ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.**

## ઇન્કમ ટેક્સ બાર એસોસીએશનના નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા



**ધ્રુવિન મેહતા**  
પ્રમુખ



**CA શ્રીધર શાહ**  
સેક્રેટરી

**ભવ્ય પોપટ-એડિટર અને ટેક્સ ટુડે પરિવાર**



## જામીનગિરિ પેટે વેપારીએ આપેલ રકમ ૨૫ જૂન ૨૦૨૨ સુધી પરત કરવા ગુજરાત વેટની ખાસ ઝુંબેશ

**ચલણ દ્વારા ભરવામાં આવેલ રકમ ૨૫ જૂન સુધીમાં અને NSC જેવી જામીનગિરિઓ ૩૦ જૂન સુધીમાં પરત કરવા અધિકારીઓને સૂચના**



તા. ૦૫.૦૬.૨૦૨૨ : ગુજરાત વેટ કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવા વેપારીઓએ જામીનગિરિ આપવાની જોગવાઈ હતી. આ જામીનગિરિઓ સામાન્ય રીતે વેપારી ઉપર કોઈ માંગણું ના હોય તો બે વર્ષમાં પરત કરવાની રહેતી હોય છે. પરંતુ વહીવટી કારણોસર મોટા પ્રમાણમાં આવી જામીનગિરિઓ વેપારીઓને પરત કરવામાં આવી નથી તેવી ફરિયાદો વારંવાર ઉઠતી રહેતી હોય છે. આ અંગે ગુજરાત વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સરાહનીય પગલું ભરી આ જામીનગિરિ વેપારીઓને પરત કરવા એક ખાસ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. ૦૪ જૂન ૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવેલ અધિકારિક સૂચના પ્રમાણે વેટ હેઠળના તમામ અધિકારીઓને

રોકડમાં ચલણ દ્વારા વેપારીએ ભરેલ જમીનીરીઓ ૨૫ જૂન ૨૦૨૨ સુધીમાં તથા તે સિવાયની NSC, બેન્ક ગેરંટી જેવી જમીનીરીઓ ૩૦ જૂન સુધીમાં વેપારીઓને પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ સફળ થશે તો વેપારીઓને પોતાના રોકાયેલ રકમ પરત મળશે તથા વેટ ડિપાર્ટમેન્ટ ઉપર આ જામીનગિરિ સાચવવાનું ભારણ પણ ઓછું થશે. ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન તથા અન્ય એસોસિએશન દ્વારા આ અંગે સતત વેટ ડિપાર્ટમેન્ટ સાથે મસલતો હાથ ધરવામાં આવતા આ પ્રકારની ઝુંબેશ બહાર પાડવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે. આ અંગે વાત કરતાં ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ હર્નિશ મોદ જણાવે છે કે “વેપારીઓની

જામીનગિરિ પરત કરવાની કામગીરી સત્વરે થઈ જોઈએ. આ કારણે જ અમારા એસોસિએશન દ્વારા સતત વેટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી આ બાબત ઘટતું કરવા માંગ કરવામાં આવી રહી હતી. હું કમિશનરશ્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓનો પણ આ તકે આભાર માનું છું અને આશા સેવું છું કે કચેરી સ્તરે પણ અધિકારીઓ આ ઝુંબેશને સફળ બનાવવા તથા વેપારીઓના હિતમાં આવી જામીનગિરિ સમયસર પરત કરશે.” આ ઝુંબેશ તેના હેતુ પૂર્ણ કરે અને અધિકારીઓ ઓ પણ ઉદારભાવે આ ઝુંબેશને સહયોગ આપે તેવી આશા વેપારી વર્ગ સેવી રહ્યો છે.

**ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે**

## કાયદાની આટીધુટીઓ અને તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ !

જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે કાયદાની આટીધુટીઓની જોડ ગુચવનારી તો હોય જ છે પણ સાથે-સાથે તેમાં એક અલગ પ્રકારની ગમ્મત પણ જોડાયેલી હોય છે. તો ચાલો જાણીએ થોડાક એવા જ કાયદાની આટીધુટી અને ગમ્મત ભરેલા કિસ્સાઓ અંગે...

### 1) Tax deduction for heart surgery!

આ કિસ્સાની અંદર શાંતિ ભુષણ નામના પ્રખ્યાત વકીલે પોતાના હૃદયના ઓપરેશન માટે થયેલ ખર્ચને ધંધાનો ખર્ચ બતાવીને બાદ લીધેલો હતો. એ અંગે તેઓએ પોતાની મુખ્ય બે દલીલ મુકી હતી કે તેમને આ ખર્ચ આયકરની કલમ ૩૧ અન્વયે રીપેર તરીકે બાદ મળવી જોઈએ અથવા તો કલમ ૩૭ અન્વયે ધંધાના અન્ય ખર્ચ તરીકે બાદ મળવી જોઈએ.

આ અંગે નામદાર કોર્ટે એ ટકોર કરતા જણાવેલું કે જો આ ખર્ચને કલમ ૩૧ અન્વયે બાદ આપીએ તો તમારું હૃદય તમારા ધંધાના સરવૈયામાં મિલકત તરીકે હોય જોઈએ અને આ ખર્ચને કલમ ૩૭ અન્વયે પણ ગણી ના શકીએ.

આ કિસ્સાની અંદર નામદાર દિલ્હી હાઈકોર્ટના જજ એ ગાલિબ ને ટાકતા કહ્યું હતું કે... "dil-e-nadan tuije hua kya hai akhir is dard ki dava kya hai"

### 2) Paid v/s Payable !

આ Paid v/s Payable ના અર્થઘટનનો મુદ્દો સુપ્રિમ કોર્ટે પાસે Palam Gas Service ના કેસમાં આવેલો. આ કેસ માટે આયકરની કલમ 40(a)(ia) ના શબ્દોને જાણવા ખુબ જરૂરી છે

જે નીચે મુજબ છે.

Any interest, commission or brokerage, rent, royalty, fees for professional services, fees for technical services, any amount payable to a resident contractor or sub contractor, if in respect of such

Tax has not been deducted, or

After deduction has not been paid on or before the due date mentioned under section 139(1) of Income Tax Act 1961

30% of such amount on which tax has not been deducted shall not be allowed as a deduction in the previous year in which the expenses are incurred, while computing the income chargeable under the head Profit and gains of business or profession.

તો આ કેસની અંદર Palam Gas Service એ કલમના શબ્દોનું કડક પાલન કરીને પોતે કરેલા કલમ 194 C ના ખર્ચનો કર કપાત ના કરેલો અને એવું કહેલું કે તેમનો આ ખર્ચ ૩૧ માર્ચ એ Payable ના હતો અને કર કપાતની જવાબદારી Payable ઉપર જ આવે અને Paid ઉપર નહીં.

આ કેસની અંદર નામદાર સુપ્રિમ કોર્ટે એ કલમના અર્થઘટન માટે Payable ને Paid સમજીને જ અર્થઘટન કરવાનું કહ્યું અને નામદાર અલ્હાબાદ હાઈકોર્ટનો કરદાતા તરફેણનો ચુકાદો ફેરવ્યો.

### 3) Whether Sachin Tendulkar is an Actor or



By Bhargav Ganatra (Author is a CA student)

### Cricketer?

આ કિસ્સો આયકર ના ચેપ્ટર VI ના ડિડક્શન હેઠળનો છે જેમાં 80RR અંગે એવું પ્રાવધાન છે કે જો કોઈ Indian Resident ની આવકમાં NRI પાસેથી રકમ મળેલી હોય (FEMA ની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને) અને તે Resident Indian જો લેખક, પ્લેસ્ટીડર, આર્ટિસ્ટ, સંગીતકાર કે નાટ્ય સાથે જોડાયેલી વ્યક્તિ હોય તો તેને તે રકમ ના નક્કી કરાયેલા પ્રાવધાન અંગે રકમ બાદ મળે.

વર્ષે ૨૦૧૧ની અંદર જયારે ભારતે વર્લ્ડકપ જીત્યો ત્યારે જયારે સચીનને ક્રિકેટના ભગવાન માનવામાં આવતા હતા ત્યારે તે પોતાને એક બાજુ અભિનેતા સાબિત કરવામાં લાગેલા હતા. સચીનને ભુતકાળમાં એડવર્ટાઈઝમેન્ટ અને સ્પોન્સરશીપની આવક વિદેશથી થયેલી હતી જે બદલ તેઓએ 80RR અંગે રકમ બાદ લીધેલી હતી.

AO અને CIT એ આ 80RRની સ્વીકૃતિ ના કરી કારણ કે સચીન ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિ છે અને નાટ્ય સાથે નહીં.

પછી આગળ જતા ITAT એ સચીનના કલેમ ને વેલીડ ગણાવ્યો જે મા તેમનો મુખ્ય આધાર એ હતો કે થુ કોઈ એક વ્યક્તિ એક સમયે બે પ્રોફેશન

સાથે જોડાયેલ ના હોઈ શકે ?

### 4) Can illegal Business Loss is allowed under Income Tax ?

આ કેસ નામદાર સુપ્રિમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ સાથે જે Dr. T.A. Querashi ના કેસ સાથે જોડાયેલ છે.

Dr. T. A. Querashi પોતે ડોક્ટરી વ્યવસાય સાથે સાથે ડ્રગ્સના અવેધ ધંધા સાથે પણ જોડાયેલ હતા. આ અવેધ ધંધા બદલ ઓથોરીટી (CBI) એ તેમનો ડ્રગ્સનો ધંધો Seize કરેલો અને NDPS કાયદા હેઠળ કાયેવાહી કરેલી.

કરદાતા એ આ માલ જમીના નુકશાનને ધંધાના નુકશાન તરીકે ગણીને બાદ લીધો જેને AO એ નકારતા જણાવ્યું કે કલમ ૩૭ અન્વયે illegal Expense ધંધાના ખર્ચ તરીકે બાદ ના મળે.

નામદાર કોર્ટે એ આ કિસ્સાની અંદર કલમનું અર્થઘટન કરતા જણાવ્યું કે illegal Expense કલમ ૩૭ અન્વયે બાદ ના મળી શકે પણ કાયદો illegal Business Loss અંગે ચુપ છે. માલ જપ્તીથી થયેલું નુકશાન ખર્ચનું નુકશાન નથી. જેથી કરદાતા આ loss ને બાદ લઈ શકે.

### 5) Classification of goods!

Classification of goods નો પ્રશ્ન સામાન્ય રીતે કોઈ એક વસ્તુની અપ્રત્યક્ષ કરની બે અલગ અલગ કરપાત્રતા હોય તો તે બે માથી એક વ્યાજબી કરપાત્રતા નક્કી કરવા માટે થાય છે.

આજે પણ આપણે જેવી રીતે જોઈએ છે તે રીતે જીએસટીમાં Roti v/s Parrota તથા Fryum v/s Papad જેવા ઉદાહરણો છે.

પણ આ પ્રશ્નો માત્ર જીએસટી સુધી જ સિમિત હતા તેવું ના કહી શકીએ. આ બાબતે ખુબ જ ચર્ચામાં રહેલો કિસ્સો કહી શકીએ તો KitKat ને લગતો છે. સામાન્ય રીતે બિસ્કીટ માં ઉત્પાદક માટે ઓછો કર હતો. (ચોકલેટ ના કરની સરખામણીમાં).

KitKat ને શું બિસ્કીટ ગણવું કે ચોકલેટ ? આ પ્રશ્નનું નિરાકરણ Nestle v/s Commissioner of Central Excise માં આવેલું જેમાં KitKat ને બિસ્કીટ તરીકે ઓળખાણ આપવામાં આવી હતી.

**Extra Shots :-** જયારે જયારે કરપાત્રતા અને તેને લગતા કાયદાકીય કિસ્સાઓની વાત આવે ત્યારે પાલખીવાલા સાહેબનું આ પ્રખ્યાત કથન યાદ રાખવા જેવું છે કે...

When a government, Which is so unfair and unjust, complains of tax evasion, it should remember that just as every nation gets the government it deserves, every government gets the taxpayer it deserves.

**(સંપાદક નોંધ:** ભાગલભાઈ દ્વારા લખવામાં આવેલ આ લેખ ખૂબ રસપ્રદ છે. CA સ્ટુડન્ટ હોવા સાથે તેઓ સતત વાંચનમાં પ્રવૃત્ત રહેતા હોય છે. આ લેખની માહિતી વાંચી જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એ શબ્દો યાદ આવે છે “પ્રોબલેમસ તો હો સબ કે સાથ બસ નઝહરીએ કી હો બાત”. આ લેખ લખવા બદલ તેઓને હાર્દિક અભિનંદન. ભવિષ્યમાં પણ તેઓ આવા લેખ લખતા રહે તેવી આશા.)

## વેપારીઓને મહત્વની રાહત!!! તપાસ દરમિયાન જી.એસ.ટી. અધિકારી નહીં કરે રકમ ભરવા દબાણ!!

**જી.એસ.ટી. તપાસ હેઠળ અધિકારી દ્વારા આદેશ પસાર કર્યા વગર કોઈ વસૂલાત થઈ શકે નહીં: CBIC**

તા. ૨૬.૦૫.૨૦૨૨ : જી.એસ.ટી. હેઠળ કોઈ કરદાતા વિરુદ્ધ કરચોરીની માહિતી ઉપરથી તપાસ હાથ ધરવામાં આવી હોય તેવા કેસોમાં તપાસ પૂર્ણ થયે સામાન્ય રીતે DRC-03 દ્વારા કરદાતાને દબાણપૂર્વક પેમેન્ટ કરાવવામાં આવતું હોય છે. DRC-03 દ્વારા કરવામાં આવતું પેમેન્ટ એ મરજિયાત પેમેન્ટ છે અને કરદાતા મરજી દ્વારા આ ફોર્મ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ ચૂકણવું કરી શકે છે. પરંતુ કરદાતા ઉપર તપાસ દરમિયાન દબાણ કરી, તપાસના અંતે આ પ્રકારે DRC-03 કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો સતત ઉઠી રહી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અન્ય હાઈકોર્ટોમાં પણ આ અંગે કરદાતા દ્વારા રિટ પિટિશન કરવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે. આ ફરિયાદો ધ્યાને લઈ જી.એસ.ટી. નું નિયમન



કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા ૨૫ મે ૨૦૨૨ ના રોજ સૂચના (ઈન્સ્ટ્રક્શન નંબર ૨/૨૦૨૨-૨૩) બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનામાં તમામ

અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે અધિકારી દ્વારા કોઈ પણ વસૂલાત કાયદા હેઠળ યોગ્ય આદેશ પસાર કર્યા પછી જ થઈ શકે છે. DRC-03 દ્વારા તપાસ દરમિયાન કોઈ પણ રકમની વસૂલાત કરવા કરદાતા

નહીં. આ સૂચનામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અધિકારી દ્વારા કરદાતાને DRC-03 દ્વારા મરજિયાત રકમ ભરવા અંગેની જોગવાઈની જાણ કરવાની રહેશે. આ સૂચના દ્વારા પ્રિન્સિપાલ કમિશનર, ચીફ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે આ રીતે તપાસ દરમિયાન ફરજિયાત DRC-03 ભરાવવામાં આવ્યું હોય તે અંગેની ફરિયાદ મળે ત્યારે આ ફરિયાદની યોગ્ય તપાસ ત્વરિત ધોરણે કરવામાં આવે અને જો આ તપાસમાં કોઈ અધિકારી દોષી સાબિત થાય તો તેના ઉપર આકરા પગલાં પણ લેવામાં આવે. આ પ્રકારની વહીવટી સૂચનાને વેપારી વર્ગ તથા ટેક્સ પ્રોફેશનલ્સ વર્ગમાં સારો આવકાર મળી રહ્યો છે.

**ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે**

## ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટેક્સ બાર એસોસિએશનના હોદ્દેદારો નિમાયા

તા. ૨૧.૦૫.૨૦૨૨ : વેરાવળ, ઉના, તાલાલા જેવા તાલુકાઓનો સમાવેશ કરતા ગીર સોમનાથ જિલ્લાના ટેક્સ પ્રોફેશનલ્સના એસોસિએશન એવા ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટેક્સ બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની નિમણૂક ૨૦ મે ૨૦૨૨ ના રોજ એસોસિએશનની સાધારણ સભામાં કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે એસોસિયેશનના પ્રમુખ તરીકે વેરાવળના એડવોકેટ સંજયભાઈ તમાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ છે. આ ઉપરાંત સેક્રેટરી તરીકે ઉનાના ભવ્ય ડી. પોપટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે તાલાલાના વિપુલભાઈ ગોસ્વામી, ખજાનચી તરીકે વેરાવળના ટેક્સ કન્સલ્ટન્ટ હરીશ સાવજીયાની તથા સહ ખજાનચી તરીકે ઉનાના CA તેજસ છગની નિમણૂક કરવામાં આવેલ છે. આ ઉપરાંત એસોસિએશનના વરિષ્ઠ સભ્યો એવા રમેશભાઈ કોટક, રઘુભાઈ ચોમાલ તથા હર્ષદભાઈ દેસાઈનાની નિમણૂક એડવાઈસરી કમિટીમાં કરવામાં આવેલ છે. સંસ્થાની કમાન સાંભળતા સાથે નવન્યુકત પ્રમુખ સંજયભાઈ તમાને પૂર્વ પ્રમુખ નવીનભાઈ ભીડોરાની એસોસિએશનને આપવામાં આવેલ સેવાઓ બિરદાવી હતી. પૂર્વ પ્રમુખ વ્યવસાય માંથી નિવૃત્ત થતાં હવે સંસ્થાના નવા પ્રમુખ તરીકે



તેઓની ન્યૂકતી બદલ તેઓએ સંસ્થાના સભ્યોનો આભાર માન્યો હતો અને સૌને ખાત્રી આપી હતી કે તેઓ સંસ્થાના હિત માટે પોતાના પૂરા પ્રયત્નો કરશે. સંસ્થા, સભ્યો તથા વ્યવસાયના હિત માટે સૌ સભ્યોને પણ એસોસિએશનમાં સક્રિય રહેવા અપીલ કરી હતી.

**ચ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે**

## GSTR 4માં ૧ મે ૨૦૨૨ બાદ ભરવામાં આવેલ લેઈટ ફી રિફંડ થશે ???

**૧.૦૫.૨૦૨૨ થી ૩૦ જૂન ૨૦૨૨ સુધી GSTR 4માં લેઈટ ફી કરવામાં આવી માફ**

તા. ૨૬.૦૫.૨૦૨૨ : કંપોઝિશન હેઠળ વેરો ભરવા જવાબદાર કરદાતાઓને જી.એસ.ટી.હેઠળ મહત્વની રાહત આપવામાં આવી છે. ૦૧.૦૫.૨૦૨૨ થી ૩૦.૦૬.૨૦૨૨ વચ્ચે ભરવામાં આવતા GSTR 4 ને લેઈટ ફી માફ કરવામાં આવી છે. ૨૬ મે ૨૦૨૨ ના રોજ આપવામાં આવેલ આ નોટિફિકેશન ૦૭/૨૦૨૨ દ્વારા લેટ ફી માં આ માફી આપવામાં આવી છે. આ માફીની જાહેરાત થયા બાદ ટેક્સ પ્રોફેશનલ્સમાં એ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે કે જે કરદાતાઓ દ્વારા ૦૧ મે ૨૦૨૨ થી ૨૬ મે ૨૦૨૨ સુધી જે કરદાતાઓ એ લેઈટ ફી ભરવામાં આવી છે તે લેઈટ ફી શું રિફંડ કરવામાં આવશે?? આ

અંગે બસે મત પ્રવર્તે છે. લેખકના અંગત મત પ્રમાણે આ ૦૧ મે ૨૦૨૨ થી જે GSTR 4 ભરવામાં આવ્યા હોય અને તેના ઉપર જે લેટ ફી લગાડવામાં આવી હોય તે રિફંડ કરદાતાને આપવામાં આવશે. આ ૨૦૨૨ ના બદલે ૦૧ મે ૨૦૨૨ થી અમલી બનાવવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં એવા શબ્દોનો પણ ઉલ્લેખ નથી કે જે કરદાતાઓ એ લેઈટ ફી ભરી આપી છે તેઓને રિફંડ આપવામાં આવશે નહીં. જો કે GSTN ને સમજવું મુશ્કેલ જ નહીં અશક્ય છે!! હવે, આશા રાખીએ કે જે કરદાતાઓ એ ૦૧ મે બાદ લેઈટ ફી ભરેલ છે તે જલ્દી પરત કરવામાં આવે!!

**ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે**

## GST હેઠળ લેઈટ ફી માં મોટી રાહત!!

**૧.૦૫.૨૦૨૨ થી ૩૦ જૂન ૨૦૨૨ સુધી GSTR 4માં લેઈટ ફી કરવામાં આવી માફ**

તા. ૨૬.૦૫.૨૦૨૨ : કંપોઝિશન હેઠળ વેરો ભરવા જવાબદાર કરદાતાઓને જી.એસ.ટી.હેઠળ મહત્વની રાહત આપવામાં આવી છે. ૦૧.૦૫.૨૦૨૨ થી ૩૦.૦૬.૨૦૨૨ વચ્ચે ભરવામાં આવતા GSTR 4 ને લેઈટ ફી માફ કરવામાં આવી છે. ૨૬ મે ૨૦૨૨ ના રોજ આપવામાં આવેલ આ નોટિફિકેશન ૦૭/૨૦૨૨ દ્વારા લેટ ફી માં આ માફી આપવામાં આવી છે. આ માફીની જાહેરાત થયા બાદ ટેક્સ પ્રોફેશનલ્સમાં એ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે કે જે કરદાતાઓ દ્વારા ૦૧ મે ૨૦૨૨ થી ૨૬ મે ૨૦૨૨ સુધી જે કરદાતાઓ એ લેઈટ ફી ભરવામાં આવી છે તે લેઈટ ફી શું રિફંડ કરવામાં આવશે?? આ અંગે બસે મત પ્રવર્તે છે. લેખકના



અંગત મત પ્રમાણે આ ૦૧ મે ૨૦૨૨ થી જે GSTR 4 ભરવામાં આવ્યા હોય અને તેના ઉપર જે લેટ ફી લગાડવામાં આવી હોય તે રિફંડ કરદાતાને આપવામાં આવશે. આ ૨૦૨૨ ના બદલે ૦૧ મે ૨૦૨૨ થી અમલી બનાવવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં એવા શબ્દોનો

પણ ઉલ્લેખ નથી કે જે કરદાતાઓ એ લેઈટ ફી ભરી આપી છે તેઓને રિફંડ આપવામાં આવશે નહીં. જો કે GSTN ને સમજવું મુશ્કેલ જ નહીં અશક્ય છે!! હવે, આશા રાખીએ કે જે કરદાતાઓ એ ૦૧ મે બાદ લેઈટ ફી ભરેલ છે તે જલ્દી પરત કરવામાં આવે!!!

**ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે**

(આ અખબાર પ્રકાશિત કરવામાં શક્ય તેટલી કાળજી લેવામાં આવેલ છે. છતાં આ લેખનાં વિચારો લેખકોના અંગત મંતવ્યો પર આધાર રાખે છે. ટેક્સ ટુડે માલિક અથવા તંત્રી આ અંગે કોઈ રીતે જવાબદાર રહેતા નથી.)



# PAN Aadhar લીંકિંગ કરવું ફરી થયું છે શરૂ, ભરવી પડશે લેઈટ ફી

**PAN-Aadhar લિન્ક છે તે ચકાસવા કરદાતા આ લિન્ક <https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar>નો ઉપયોગ કરી શકે છે.**

તા. ૧૩.૦૬.૨૦૨૨

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિની ઓળખ PAN એટ્લે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર દ્વારા કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ હેઠળ મહત્વનો સુધારો કરી ૦૧ એપ્રિલ ૨૦૧૭ થી દરેક PAN કાર્ડને Aadhar કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત બનાવી આપવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ હેઠળ આ PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં વારંવાર વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લે દરેક કરદાતાએ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં પોતાના PAN ને Aadhar સાથે લિન્ક કરવા જરૂરી હતા. કોઈ કરદાતા PAN-Aadhar લિન્ક ના કરે તો તેનું PAN અમાન્ય થઈ જઈ તેવી જોગવાઈ ઇન્કમ ટેક્સ કાયદામાં કરવામાં આવેલ છે.

**PAN-Aadhar લિન્ક ના હોય તો પડી શકે છે આ મુશ્કેલી:**

- કરદાતા પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે નહીં.
- કરદાતાએ ફાઇલ કરેલ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થઈ શકે નહીં.
- કરદાતાના બાકી રિફંડ મળી શકે નહીં.
- કરદાતાનો TDS, PAN માન્ય ના હોવાથી ઊંચા દરે થઈ જાય છે.

**Aadhar સાથે લિન્ક ના થયા હોય તેવા અનેક PAN**

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે Aadhar સાથે લિન્ક ના થયા હોય તેવા

PANની સંખ્યા ખૂબ મોટી હતી. આ તમામ PAN જો અમાન્ય કરી આપવામાં આવે તો ઘણા કરદાતા આ કારણે હેરાન થઈ જાય તેવી શક્યતા રહેલી હતી. દર વર્ષે સરકાર દ્વારા PAN ને Aadhar સાથે લિન્ક કરવાની મુદતમાં વધારો કરવામાં આવતો હોય ઘણા કરદાતા PAN-Aadhar લિન્ક કરાવવા બાબતે જોઈએ તેટલા ગંભીર ના હતા. આ કારણે ૩૧ માર્ચ ૨૨ ના રોજ PAN-Aadhar લિન્કની મુદત વધારવા સાથે સરકાર દ્વારા કરદાતાઓ ઉપર લેઈટ ફી લાગુ કરવામાં આવી.

**હવે PAN-Aadhar મોડુ લિન્ક કરાવવાથી ભરવી પડશે Late Fee**

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. કોઈ કરદાતા કોઈ પ્રશાસનિક બાબતોમાં વિલંબ કરે, કાયદા હેઠળ કરવાપાત્ર કોઈ વિધિઓ કરવામાં વિલંબ કરે ત્યારે કરદાતા ઉપર લેઈટ ફી તરીકે દંડ નોંખવામાં આવતો હોય છે. આ લેઈટ ફી બચાવવા કરદાતા કાયદા હેઠળ સુચવવામાં આવેલ વિધિ સમયસર પૂરી કરતાં હોય છે અથવા તો મોડા થાય ત્યારે લેઈટ ફી ભરવા જવાબદાર થતાં હોય છે. TDS રિટર્ન મોડુ ભરવામાં આવે, ઇન્કમ ટેક્સ રિટર્ન મોડુ ભરવામાં આવે ત્યારે અગાઉ પણ લેઈટ ફી વસૂલવામાં આવતી હતી. હવે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ PAN Aadhar લિન્ક કરવામાં મોડુ કરવામાં આવે ત્યારે પણ લેઈટ ફી લાગુ કરવામાં આવી છે. પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કોઈ કરદાતા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી પોતાનું PAN, Aadhar સાથે લિન્ક ના કરાવે ત્યારે તેઓ લેઈટ ફી ભરવા જવાબદાર બની



જશે. ૩૧ માર્ચ પછી પણ ૩૦ જૂન પહેલાં જો PAN-Aadhar લિન્ક કરાવવામાં આવે તો કરદાતા ૫૦૦ રૂ ની લેઈટ ફી ભરવા જવાબદાર બનશે. ૩૦ જૂન ૨૦૨૨ પછી જો આ PAN-Aadhar લિન્ક કરવામાં આવશે તો કરદાતા ૧૦૦૦ રૂ ની લેઈટ ફી ભરવા જવાબદાર બનશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની પ્રવર્તમાન જાહેરાત મુજબ કોઈ PAN ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી Aadhar સાથે લિન્ક કરાવવામાં નહીં આવ્યા હોય તો તેવા PAN અમાન્ય થઈ જશે.

**લેઈટ ફી બચાવો, આજે જ PAN ને Aadhar સાથે લિન્ક કરો:**

છેલ્લા ઘણા સમયથી PAN-Aadhar લિન્ક કરવાની કાર્યવાહી ડેનિકલ કારણોસર બંધ હતી. હાલ થોડા દિવસો પહેલાં આ લીંકિંગની કાર્યવાહી

ફરી શરૂ થઈ છે. હાલ કોઈ કરદાતા દ્વારા પોતાનું PAN લિન્ક કરવામાં આવે છે તો તેઓ ૫૦૦ રૂ ની લેઈટ ફી ભરી આ કામગીરી કરી શકે છે. ૩૦ જૂન ૨૦૨૨ પછી આ કામગીરી માટે ૧૦૦૦ ની લેઈટ ફી ભરવાની જવાબદારી આવશે. આ વધારાની લેઈટ બચાવવા આજે જ કરદાતા પોતાનું PAN-Aadhar સાથે લિન્ક કરાવે તે જરૂરી છે.

**PAN Aadhar લિન્ક કરવામાં અમુક કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી**

PAN ને Aadhar સાથે લિન્ક કરવામાં ઘણા કરદાતાઓને ખાસ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મહિલા કરદાતા આ બાબતે વધુ મુશ્કેલી ભોગવી રહ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ માટેના કારણની વાત કરીએ

તો મહિલા કરદાતા જ્યારે લગ્ન પહેલાંના Aadhar કાર્ડ ધરાવતા હોય અને PAN લગ્ન બાદ મેળવેલ હોય તેવા સંજોગોમાં PAN અને Aadhar માં નામમાં ફેર આવે છે. આ ફેરના કારણે Aadhar સાથે PAN લિન્ક કરી શકતું હોતું નથી. આવી રીતે નોકરી કરતાં મહિલાઓના અભ્યાસના દસ્તાવેજ પુરાવા પોતાના પિતાના નામ સાથેના હોય છે. આ કારણે તેઓની નોકરીમાં નામ પિતાના નામ સાથેના નામ ધરાવતું હોય છે. જ્યારે લગ્ન બાદ પોતાના પતિ સાથેના નામ સાથે Aadhar ધરાવતા હોય છે. આ કારણે પણ લિન્ક કરવામાં તકલીફ પડતી હોય છે. આ સિવાય પણ નાની નાની સ્પેલિંગની ભૂલોના કારણે પણ પોતાના PAN-Aadhar લીંકિંગમાં તકલીફ પડતી હોય.

**PAN-Aadhar લીંકિંગ ૦૧ એપ્રિલથી ૩૧ મે સુધી હવું સંપૂર્ણપણે બંધ**

મળતી માહિતી પ્રમાણે ૦૧ એપ્રિલ ૨૦૨૨ થી PAN Aadhar લિન્ક કરવાની વિધિ સ્થગિત કરી આપવામાં આવી હતી. આ વિધિ ૦૧ જૂન ૨૦૨૨ થી વિધિવત રીતે ચાલુ કરવામાં આવી છે. હાલ, જે કરદાતાઓને માત્ર Aadhar માં તેઓ દ્વારા ફેરફાર કરાવવાના કારણે PAN-Aadhar લિન્ક કરવાના થતાં હોય તે માત્ર લિન્ક થઈ શકે છે. જે કરદાતાઓ માટે ઝગમગ માં સુધારા કરવાના થઈ છે તેના માટે હજુ આ સુધારા કરવાના વિકલ્પ શરૂ કરવામાં આવ્યો નથી.

**PAN સુધારવા માટેનો વિકલ્પ ક્યારે થશે શરૂ??**

અમુક સંજોગોમાં કરદાતાએ PAN કાર્ડમાં બદલાવ કરાવવો જરૂરી હોય છે. તેઓના Aadhar કાર્ડની વિગતો યોગ્ય હોય છે. PAN

સાથે Aadhar લિન્ક ના હોય તેવા કિસ્સામાં PAN સુધારવા પાત્ર હોય તેવા કરદાતા હાલ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેઓ માટે PAN સુધારવા માટેનો વિકલ્પ હાલ બંધ છે તેવી માહિતી મળી રહી છે. હાલ NSDL (ઓનલાઈન PAN અંગે અરજ કરવા અધિકૃત કંપની)ની વેબસાઈટ ઉપર એવો સંદેશો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે કે હાલ PAN-Aadhar લિન્કના હોય તેવા કિસ્સામાં PAN સુધારા અંગે અરજ કરી શકાય નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ખુલાસો આવશે ત્યારબાદ આ વિકલ્પ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આ વેબસાઈટમાં આપવામાં આવી રહી છે. હવે, આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો ખુલાસો ક્યારે આવશે, ક્યારે કરદાતા આ ઝગમગમાં સુધારો કરશે અને ક્યારે કરદાતા પોતાના સુધારેલા PAN સાથે Aadhar લીક કરશે તે વિચારવા જેવી બાબત છે.

**૩૦ જૂન ૨૦૨૨ ના રોજ પૂરી થતી મુદત વધારવી છે જરૂરી:**

૫૦૦ રૂની લેઈટ ફી સાથે PAN-Aadhar લિન્ક કરવાની મુદત ૩૦.૦૬.૨૦૨૨ છે. આ મુદતમાં વધારો થાય તે અત્યંત જરૂરી છે. આ સાથે એ પણ જરૂરી છે કે PAN-Aadhar લિન્ક ના હોય તેવા PAN સુધારવાની વિધિ પણ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી આશા પણ કરદાતાઓ સેવી રહ્યા છે. જો આ PAN સુધારવાનો વિકલ્પ શરૂ કરવામાં નહીં આવે તો આ ચોક્કસ પાડાના વાકે પખાલીને ડામ આપવા જેવી બાબત થશે.

## જી.એસ.ટી.માં બિલિંગ પ્રવૃત્તિ દ્વારા થઈ રહી છે મોટા પ્રમાણમાં કરચોરી!!

જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અવારનવાર કરચોરીના મોટા કૌભાંડોના સમાચાર વાંચવા-સાંભળવા મળી રહ્યા છે. અર્થતંત્રમાં મોટો પ્રમાણમાં કરદાતાઓ જી.એસ.ટી. ચોરી કરી રહ્યા હોવાનું જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટની માન્યતા છે. ગુજરાતમાં ભાવનગર તથા આસપાસના વિસ્તારોમાં થોડા સમય પહેલાં બહાર આવેલા મોટા જી.એસ.ટી. કૌભાંડના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ ખૂબ સતર્ક બની ગયું છે. આની સીધી અસર જી.એસ.ટી. દ્વારા નવા આપવામાં આવી રહેલા નોંધણી નંબરમાં પડી રહી છે. નવા નોંધણી નંબર મેળવવા માટેની અરજીઓ મોટા પ્રમાણમાં નકારવામાં આવી રહી હોવાની માહિતી જ મીની સ્તરે મળી રહી છે. ડિપાર્ટમેન્ટના અધિકારીઓ નામ ના આપવાની શરતે જણાવે છે કે તેઓને ડર છે કે જી.એસ.ટી. હેઠળ નવો નોંધણી દાખલો મેળવવા અરજ કરતા ઘણા મોટા પ્રમાણમાં વેપારીઓ બોગસ બિલિંગ દ્વારા કરચોરી આચરનારા વ્યક્તિઓ છે. જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટની આ માન્યતાના કારણે પ્રમાણિક કરદાતાઓ પણ જી.એસ.ટી. મેળવવામાં તકલીફ અનુભવી રહ્યા છે.

**કેવી રીતે આચરવામાં આવે છે કરચોરી??**

જી.એસ.ટી. હેઠળ કરચોરી મુખ્યત્વે બે રીતે આચરવામાં આવે છે. એક રીતે વેપારી બિલ બનાવ્યા વગર માલનું વેચાણ કરે છે. આ પદ્ધતિ ઘણી જૂની છે અને આ વિષે ખરીદનાર તથા વેચનાર મોટા ભાગે જાણકારી ધરાવતા હોય છે. કરચોરી આચરવાની અન્ય એક રીત એવી છે કે જ્યાં વેપારી માલનું વેચાણ કરતો નથી પરંતુ માત્ર બિલ આપી ટેક્સ કેડિટ ખરીદનારને આપે છે. આ બન્ને પદ્ધતિ દ્વારા માર્કેટમાં મોટા પ્રમાણમાં કરચોરી આચરવામાં આવી રહી હોવાની આશંકા જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ સેવી રહ્યું છે. માત્ર બિલ આપી માલ ના વેચવામાં આવે તેમાં કરચોરી કેવી?? વેપાર સાથે જોડાયેલા અનેક વેપારીની માન્યતા હોય છે કે કોઈ ખરીદનાર માલ ના ખરીદે આમ છતાં તેને બિલ આપવામાં આવે તો તેમાં જી.એસ.ટી. ચોરી થતી જ નથી. તેઓની આ માન્યતાનું કારણ આ છે કે તેઓ ના મતે તેઓ દ્વારા માલ તો વેચાણ કરવામાં આવ્યો જ છે. આમ, માલ પણ વેચાઈ ગયો છે, આ માલ ઉપરનું બિલ પણ તેઓ દ્વારા

**ક્યારેક જાણતા ક્યારેક અજાણ હોવાથી થઈ જાય છે કરચોરી**

# GST

## BILLING SOFTWARE

### WHOLE SALE

### RETAIL

SGST
IGST

### CGST

બનાવવામાં આવ્યું છે તો આ વ્યવહારમાં કરચોરી શેની??? આ બાબત વેપારીઓ એ ધ્યાને લેવી જરૂરી છે કે કોઈ પણ વ્યવહારમાં જે વ્યક્તિ માલની ખરીદી કરે છે તે વ્યક્તિને જ બિલ આપવું જરૂરી છે. આ પ્રકારે જ્યારે વેપારી વ્યવહાર કરે છે ત્યારે માલનું વેચાણ અને ઉપયોગ એક વ્યક્તિ કરે છે અને માલનું બિલ અન્ય વ્યક્તિના નામે બનાવવામાં આવે છે, જે વ્યક્તિ ના તો આ માલની ખરીદી કરે છે ના તો તેનો ઉપયોગ કરે છે. આવી વ્યક્તિ માત્ર બિલ ખરીદે છે માલ નહીં!! આવી પ્રવૃત્તિને જી.એસ.ટી. ની ભાષામાં બોગસ બિલિંગ ની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આ પ્રકારે બિલ ખરીદી ખરીદનાર વેપારી ના મળી શકે તેવી ઈન્પુટ ટેક્સ કેડિટ લેતા હોય છે અને આ કારણે સરકારી તિજોરીને નુકસાન જતું હોય છે. આવારસવાર સમાચાર માધ્યમમાં પ્રકાશિત થતાં જી.એસ.ટી. કૌભાંડ અંગેના સમાચાર એ મુખ્યત્વે આ પ્રકારની કરચોરી અંગેના હોય છે. વેચનાર વેપારી ક્યારેક આ અંગે જાણકારી ના અભાવે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. ક્યારેક આ ભૂલ વેપારીઓને ખૂબ મુશ્કેલ પડી જાઈ છે. એક ટેક્સ પ્રોડેશનલ તરીકે આ પ્રકારના વ્યવહારથી દૂર રહેવા ખાસ આગ્રહ કરતાં હોય છે.

**બિલિંગ કૌભાંડનો ભોગ બની શકે છે પ્રમાણિક વેપારી પણ!!**

માર્કેટમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા આ બિલિંગ કૌભાંડનો ભોગ

ઘણીવાર પ્રમાણિક વેપારી બની જતાં હોય છે. કોઈ વેપારી બોગસ બિલિંગ કરી રહ્યો છે તે જાણવું ખરીદનાર માટે સહેલું નથી. ક્યારેક કોઈ ખરીદનાર વેપારી વેચનાર પાસેથી યોગ્ય રીતે માલ પણ ખરીદે, બિલ પણ મેળવે પરંતુ જ્યારે એ વેચનાર વેપારી અન્ય વેપારીમાં બોગસ બિલિંગ કરતાં પકડાઈ ત્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ માની લે છે કે આ વેચનાર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવહારો બોગસ છે. આમ, આવા સમયે પ્રમાણિક વેપારી દ્વારા કરવામાં આવેલ વ્યવહારો ઉપર પણ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટને શંકા કરી તપાસ હાથ ધરતા હોય છે. એવા પણ અનેક કિસ્સા સામે આવે છે યોગ્ય દસ્તાવેજ પુરાવાના અભાવે પ્રમાણિક પણ ખરીદી કરી હોવા છતાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ કેડિટ અમાન્ય કરી તેની ઉપર ટેક્સ, વ્યાજ, દંડ લગાડવામાં આવતો હોય છે.

**ખરીદનાર દ્વારા શું તકેદારી રાખવી છે જરૂરી??**

ઉપર જણાવેલ છે તેમ ખરીદનાર વેપારી પ્રમાણિક હોવા છતાં બોગસ બિલિંગ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ કોઈ વેચનાર ઉપર થયેલ કાર્યવાહીનો શિકાર બની જતાં હોય છે. આવા સમયે પ્રશ્ન એ થાય કે ખરીદનાર વેપારી કેવી રીતે નક્કી કરે કે વેચનાર વેપારી પ્રમાણિક વેપારી છે, તે જી.એસ.ટી. ડિફોલ્ટર નથી, તે બોગસ બિલિંગ અંગેની પ્રવૃત્તિમાં સમાવિષ્ટ નથી??? આ અંગે જવાબ

આપવો મુશ્કેલ છે. આ મુશ્કેલી સદંતર નિવારવી શક્ય નથી, પરંતુ યોગ્ય તકેદારી રાખી આ મુશ્કેલીને મહદ અંશે નિવારી શકાય છે. ખરીદનાર જ્યારે પોતાના જાણીતા વેપારી, વર્ષોથી જેમની સાથે કામ કરે છે તેવા વેપારી સાથે વ્યવહાર કરતાં હોય ત્યારે તેઓ વેપારીને સારી રીતે ઓળખતા હોય છે, તેઓના વર્તનથી વાકેફ હોય છે, તેઓની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે ત્યારે આ પ્રકારે હેરાન થવાની શક્યતા ખૂબ ઓછી રહેતી હોય છે. પરંતુ જ્યારે વેપારી કોઈ એવા વેપારી પાસેથી ખરીદી કરે જે તેમના માટે નવા છે, વધુ ઓળખાણ નથી ત્યારે ખરીદનાર વેપારીએ જી.એસ.ટી. પોર્ટલ ઉપર ([www.gst.gov.in](http://www.gst.gov.in)) પર જઈ સર્ચ ટેક્સપેયર ના વિકલ્પમાં જઈ વેચનાર વેપારીના જી.એસ.ટી. સ્ટેટસ વિષે જાણકારી મેળવી લેવી જરૂરી છે. વેચનાર વેપારીનો જી.એસ.ટી. નંબર ચાલુ છે, તેના દ્વારા ભરવામાં આવતા જી.એસ.ટી. રિટર્ન નિયમિત ભરાઈ છે તે અંગે ખાતરી કરી લેવી જોઈએ. વેચનાર વેપારી રિટર્ન ભરવામાં અનિયમિત હોય તો ખરીદનારે ચેતી જરૂર ખૂબ જરૂરી છે. આ ઉપરાંત વેચનાર દ્વારા મોકલવામાં આવેલ બિલ, ઇ વે બિલમાં જી.એસ.ટી. નંબર, ડિલિવરીની વિગત, પ્લેસ ઓફ સપ્લાય, માલની વિગત, વેરાનો દર અને વેરો યોગ્ય છે તે તપાસી લેવી જરૂરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વેચનાર દ્વારા માલ મોકલવા અંગેની લોરી રિસીપ્ટ (LR) માલ વહનના પુરાવા તરીકે જાળવવી જરૂરી છે. એક ટેક્સ પ્રોડેશનલ્સ તરીકે ઘણી વાર એવું ધ્યાને આવે છે કે ખરીદનાર વેપારી યોગ્ય માહિતીના અભાવે LR જાળવવા વિષે ગંભીર હોતા નથી.

**બિલિંગ કૌભાંડ દ્વારા સરકારી તિજોરીને તો થાય છે નુકસાન વેપારીની શાખ પણ થાય છે અસર:** આ પ્રકારે બિલિંગ પ્રવૃત્તિ દ્વારા સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. આ પ્રકારે બિલિંગ પ્રવૃત્તિ પકડાઈ ત્યારે વેપાર તથા વેપારીની શાખને પણ ખાસ્સું એવું નુકસાન થાય છે. આ ઉપરાંત આવા સંજોગોમાં ખરીદનાર તથા વેચનાર બન્ને વેપારીઓ ઉપર વેરા, વ્યાજ, દંડ ની

જવાબદારી ઊભી થઈ જતી હોય છે. આમ, નાના ફાયદા મેળવવા લાંબા

ગાળાની મુશ્કેલીમાં વેપારી ના પડે તે



## DSC SCHOOL OF COMMERCE

Veraval Road, Near Lamdhar Fatak, UNA Mo.+91 8758470700

ધોરણ ૧૦ માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ૩૦% સુધીની સ્કોલરશીપ



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની ઉના પીપલ્સ કો-ઓપ બેન્કની મુલાકાત



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની DEO ની મુલાકાત



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની GST ઓફીસની મુલાકાત



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની INCOME TAX ઓફીસની મુલાકાત



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની મારૂતિ જીનીસ ઇન્ડ.ની મુલાકાત



DSC સ્કૂલના વિદ્યાર્થીઓની કેલારા કોટેલ પ્રા.લી.ની મુલાકાત

## એડમિશનની વધુ વિગતો માટે વિઝીટ કરો:

http://www.dscpublicschool.org

**શા માટે કોમર્સ DSC SCHOOL OF COMMERCE ???**

- કોમર્સ શીખો કોમર્સ વિષયના તજજ્ઞો પાસેથી
- વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતો
- વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ બેન્કો તથા જી.એસ.ટી., ઇન્કમ ટેક્સ જેવી સરકારી ઓફીસની મુલાકાતો
- જી.એસ.ટી. અધિકારી, ઇન્કમ ટેક્સ અધિકારી જેવા સરકારી અધિકારીઓ, નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નિષ્ણાંત વકીલો જેવા તજજ્ઞોના લેક્ચરોનો લાભ
- કોમર્સના વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓને લગતા વેબીનાર



# સવાલ આપના જવાબ 'ટેક્સ ટુડે' એક્સપર્ટના

11th June 2022

જી.એસ.ટી.

જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ ના હોવાની સ્થિતિમાં વાહનને રોકવામાં આવતું હોય છે અને આ વાહનને જી.એસ.ટી. ઓફિસ લઈ જવામાં આવતું હોય છે. જો આપણાં અસીલ ટેક્સ તથા પેનલ્ટી ભરવા તૈયાર હોય તો પણ શું આ માલ જી.એસ.ટી. ઓફિસે લઈ જવો એ કાયદાકીય રીતે બારોબાર છે? – CA કલ્પેશ પટેલ

જવાબ: સામાન્ય રીતે ટેક્સ તથા પેનલ્ટી કરદાતા ભરી આપે ત્યારે તેઓનું વાહન જી.એસ.ટી. ઓફિસ પર લઈ જવાની વિધિ અધિકારીઓ કરતાં હોતા નથી. કરદાતા જ્યારે અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી ભરી આપે તેવા સંજોગોમાં માલ અને વાહન જી.એસ.ટી. ઓફિસે લઈ જઈ શકે નહીં તેવો અમારો મત છે.

અમારા અસીલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ રાખી શેડ બનાવે છે. તેઓ પત્થર અને રેતીની URD ખરીદી કરે છે. શું તેઓ RCM ભરવા જવાબદાર બને? – નિમેશ પરિખ, જુનાગઢ

જવાબ: ના, ઉપર દર્શાવેલ સ્થિતિમાં તમારા અસીલ RCM ભરવા જવાબદાર બને નહીં તેવો અમારો મત છે.

અમારા અસીલ રેસ્ટોરન્ટ ધરાવે છે. તેઓ કંપોઝીશનમાં છે. તેઓ Swiggy/Zomato દ્વારા પોતાના માલનું વેચાણ કરે છે. શું તેઓ કંપોઝીશનનો વિકલ્પ ચાલુ રાખી શકે કે તેઓએ ફરજિયાત રેગ્યુલરમાં રહેવું પડે? – રાજ ધનેશા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, ઇ કોમર્સ ઓપરેટર દ્વારા સેવા પૂરી પાડતા કરદાતાને કંપોઝીશન વિકલ્પનો લાભ મળી શકે નહીં. તેઓ ફરજિયાત રેગ્યુલર રેઈટ પર ટેક્સ ભરવાની જવાબદારી આવે. જો કે રેસ્ટોરન્ટ માટે આમ પણ કંપોઝીશન કરતાં રેગ્યુલર વિકલ્પ વધુ સારું રહેશે.

04th June 2022

જી.એસ.ટી.

અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓને કલેરિકલ ભૂલના કારણે GSTR 4 માં ટેબલ 5 માં રકમ NIL દર્શાવેલ હતી. આ કારણે તેઓના લોગિનમાં નેગેટિવ લયાબિલિટી લેજર ઊભું થયું હતું. આ નેગેટિવ લયાબિલિટી તેઓએ DRC 03 દ્વારા સેટ ઓફ કરી હતી. હવે GSTN દ્વારા તેઓના ઉપર સુઓ મોટો કેબિટ એન્ટ્રી કરી છે અને હાલ અમારા અસીલનું કેશ લેજર નેગેટિવ દર્શાવે છે. આ સ્થિતિમાં અમારે શું કરવું જોઈએ? શું ફરીવાર આ રકમ ભરી અને ત્યારબાદ રિફંડ લેવું જોઈએ? – રમેશભાઈ કોટક, ટેક્સ એડવોકેટ, વેરાવળ

જવાબ: આ પ્રશ્ન બહુ મોટા પ્રમાણમાં કરદાતાઓ માટે ઊભો છે. હાલ, આ અંગે માનનીય ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન થઈ રહી છે. આપની પાસે આ રિટ પિટિશનનો ભાગ બનવાનો વિકલ્પ છે અથવા આ રિટ પિટિશનના કેસમાં આવતા જજમેન્ટની રાહ જોવાનો વિકલ્પ છે. GSTN દ્વારા આપવામાં આવેલ એડવાઈઝરી પ્રમાણે તમે આ રકમ ભરી રિફંડ લેવાનો વિકલ્પ પસંદ કરી શકો છો પરંતુ આ વિકલ્પમાં રિફંડ કેવી રીતે આપવામાં આવશે તે અંગે ચોક્કસ દ્વિધા રહેલ છે.

અમારા અસીલ માલિકી ધોરણે ચાંદીના ઘરેણાંનો ઘંધો કરી રહ્યા છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓ આ ઘંધો પોતાના



પુત્રને સ્ટોક, મિલકત અને જવાબદારી સાથે ગિફ્ટ કરી આપવામાં માંગે છે. આ વ્યવહાર ઉપર તેઓની જી.એસ.ટી. ની જવાબદારી આવે? – જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: ના, ધાંધની સંપૂર્ણ જવાબદારી સાથે ધંધાને તબદીલ કરવામાં આવે તેવા સંજોગોમાં તબદીલ કરનારની સ્ટોક ઉપર વેરો ભરવા જવાબદારી ના આવે તેવો અમારો મત છે. એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે આવા કિસ્સામાં પુત્ર જ્યારે જી.એસ.ટી. નંબર લે તે ટ્રાન્સફર તરીકે લે. અમો જિનિંગના અને પ્રેસિંગના ધંધાર્થી છીએ. અમારા ધંધામાં અમારો માલ ખરીદનાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કરવામાં આવે છે. આ માલની હેરફેર પણ ખરીદનાર દ્વારા જ કરવામાં આવે છે. સામાન્ય રીતે ખરીદનાર અમને (વેચનારને) ઇ વે બિલ બનાવવા જણાવે છે. શું આ પ્રકારના વ્યવહારમાં ઇ વે બિલ બનાવવાની જવાબદારી વેચનારની આવે કે ખરીદનારની? – રાજુભાઈ કાતરિયા, મારુતિ જિનિંગ, ઉના

જવાબ: જી.એસ.ટી. નિયમોના નિયમ ૧૩૮(૧) મુજબ જે વ્યક્તિ માલની હેરફેર કરવા જવાબદાર હોય તેઓ માટે ઇ વે બિલ બનાવવું જરૂરી છે. આમ, તમારા કિસ્સામાં જો ખરીદનાર માલની હેરફેર માટે જવાબદાર હોય તો ઇ વે બિલ બનાવવાની જવાબદારી તેઓની આવે તેવો અમારો મત છે.

ઈન્કમ ટેક્સ

અમારા અસિલે વર્ષ ૨૦૧૩-૧૪માં એક કોમ્પ્લેક્સ બનાવ્યો હતો. આ કોમ્પ્લેક્સમાં કુલ ૮ દુકાનો બનાવી હતી જે પૈકી ૧ દુકાનનું વેચાણ તેઓ દ્વારા ૨૦૨૧-૨૨ માં કરવામાં આવ્યું હતું. આ દુકાન વેચાણ ઉપર કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડે કે ધંધાની આવક ગણાય? – હિત લીલાણી, કચ્છ

જવાબ: આપના અસીલના કેસમાં તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં આ કોમ્પ્લેક્સને સ્થાવર મિલકત તરીકે દર્શાવવામાં આવ્યું હોય તો આ દુકાન વેચાણ ઉપર કેપિટલ ગેઈન લાગુ પડે અને જો તેઓ દ્વારા એકાઉન્ટમાં સ્ટોક

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ  
એડવોકેટ લલિત ગણપત્રા, જેતપુર  
CA દિવ્યેશ સોઢા, પોરબંદર  
એડવોકેટ ભવ્ય પોપટ

તરીકે દર્શાવવામાં આવ્યું હોય તો આ દુકાનના વેચાણ ઉપર ધંધાકીય આવક ગણવામાં આવે તેવો અમારો મત છે.

૨૧ મે ૨૦૨૨

જી.એસ.ટી.

અમારા અસીલ ઓર્થો ઇન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદન કરી વેચાણનો ધંધો કરે છે. તેઓ દ્વારા B2C (ડોક્ટર્સ) ને માલ જાંગડ વેચાણ કરવામાં આવે છે. ડોક્ટર્સ દ્વારા જેટલા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે તેટલી રકમનું જ બિલ અમારા અસિલે બનાવવાનું રહેતું હોય છે. જ્યારે માલ મોકલવામાં આવે છે ત્યારે માત્ર ડિલિવરી ચલણ મોકલવામાં આવતું હોય છે. જેટલો માલ ઉપયોગમાં નથી આવતો તે માલ ડોક્ટર દ્વારા પાછો મોકલવામાં આવતો હોય છે. આ કિસ્સામાં નીચેના પ્રશ્નો છે.

- માલની કિંમત જ્યારે ૧૦ લાખ જેવી મોટી હોય ત્યારે શું ડિલિવરી ચલણ દ્વારા માલ મોકલવામાં આવે તે યોગ્ય છે?
- માલનો ઉપયોગ થયા પછી અમારા અસીલ તેટલી જ રકમનું બિલ બનાવે તે યોગ્ય છે?
- જે માલ પાછો મોકલવામાં આવતો હોય તે માલ ડિલિવરી ચલણ દ્વારા માંગવી શકે? – પટેલ અરવિંદકુમાર રણછોડલાલ એન્ડ કુ., ટેક્સ કન્સલ્ટન્ટ, વિસનગર

જવાબ: હા, જાંગડ સ્વરૂપે માલ ડિલિવરી ચલણ દ્વારા મોકલવામાં આવે તે અમારા માટે યોગ્ય છે. ના પસંદ કરેલ માલ ડિલિવરી ચલણ દ્વારા માંગવી પણ શકાય છે. પરંતુ આ બાબતે કે વાત ધ્યાને રાખવી જરૂરી છે કે જાંગડ સ્વરૂપે મોકલવામાં આવેલ માલ જો ૬ મહિના સુધી પરત ના આવેલ હોય તો ત્યારે એ ડીપ્ડ સપ્લાય ગણાશે. આ વ્યવહારમાં વધુ એક વ્યાવહારિક વિકલ્પ એ રહે કે વેચનાર દ્વારા માલ મોકલવા સમયે વેચાણ બિલ બનાવવામાં આવે અને જ્યારે ખરીદનાર માલ પરત કરે ત્યારે ક્રેડિટ નોટ દ્વારા પરત મેળવવામાં આવે.

## Something other than Tax

# Lavasa- A dream that never came true



By Diya Popat

Lavasa, a beautiful area situated at the western part of Maharashtra near Pune. It is a first planned private town of India. The Lavasa town is planned on the beautiful Italian Town Portofino. Various streets and several buildings of Lavasa are named bearing the name of Portofino.

I got chance to visit Lavasa this vacation (May 2022) with my family. Pune is the nearest airport to Lavasa approximately 68 Kms from the town. Pune Railway Station is the nearest railway station to Lavasa approximately 60 Kms. From Pune one has to hire a taxi as there is no much public transportation between Pune to Lavasa neither any other place to Lavasa. Due to my father being engaged in one conference at Surat, we had our train from

Surat to Mumbai. The Surat Mumbai train we had is also worth mentioning. The train was Tejas Express. Friends have you heard the name of Tejas Express?? Friends it is the first private, corporate train of India managed and operated by company, IRCTC. Tejas Express has facility almost as an airplane, with Train hostess/host, quality food and nice seating arrangements. Reaching Mumbai we had taken a taxi to Lavasa. We reached Lavasa evening nearly 8.00 Pm. Lavasa is short of hotels too. The hotel we had taken was an average hotel, good with nature but bit far from town. Reaching there was not so exiting as I am not fond of travel by road. First feeling of the place Lavasa was not positive. We had our dinner and then slept. Next morning we had a walk to the town center. Almost a walk of 8 to 10 Kms made me to explore the town Lavasa. I am not an amid walker but I enjoyed the walk down to the town and back a lot. With my Dedda Mom with me we had a long walk and talk. I found many streets named Portofino

with various numbers of the street. I loved this town. But I also found many buildings which were left unconstructured. It made me curious about the reasons why these buildings were left unconstructured. I discussed with my papa and researched on the net. I found interesting facts worth sharing with you all friends.

As discussed earlier Lavasa is a first private town planned town is said to be found in the year 2000. The project was being developed by Hindustan Construction Company. Mr Ajit Gluabchand may be said as the initial identifier of the beautiful place Lavasa. This beautiful, yet to complete town has been disturbed due to multiple reasons. As per the research on net and talking to residents of the town, I found that, the purchase of land from the original land owners was first reason for delay. Due to the ban orders from environment ministry, in 2010, due to the violation of the environmental laws. Though the ban order of the environment ministry was removed in 2011. Timely non availability of the funds for the

company is also one reason behind the problems faced by the project. The company failed on the payment of the bank loans too. Whatever may be the problem, the city though not fully completed looks like a foreign tourist destination.

The city center though not maintained well still looks worth seeing. I enjoyed the next day especially the beautiful evening spent at the streets of beautifully designed Portofino. The river cruise is also a splendid attraction. I also enjoyed the food and ice cr'ime at the city center. All and all I can say that it was a day well spent.

The next day we had to leave Lavasa as we had to go to the next destination Matheran, the queen of hill station. To sum up my journey to Lavasa I can easily feel that Lavasa may have been the dream project to Mr Ajit Gulabchand, and his team, a dream which may not yet be true but somehow down my heart I still believe that the place will be again put to its actual end by developing the same.